

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

<http://www.shaktisinhgohil.com>

અખબારીયાદી

તા.૦૨.૦૧.૨૦૧૯

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ દ્વારા અપાયેલ નોટીસનો પ્રત્યુત્તર પાતાના વકીલ મારફતે આપતા જણાવ્યું છે કે શક્તિસિંહ વિરુદ્ધ પ્રસિદ્ધ થયેલ સમાચારો તેઓએ પ્રસિદ્ધ કર્યા નથી, કે કરાવ્યા નથી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચનાથી તેમના વકીલ દ્વારા શક્તિસિંહને અપાયેલ પ્રત્યુત્તરમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, “અમારા અસીલ મારફતે તમારી પ્રતિષ્ઠાને હાની પહોચે તેવો કોઈ ઈરાદો ન હતો “

અગાઉ તા :૧૬/૧૦/૨૦૧૮ના રોજ ગુજરાત વર્તમાનપત્ર તથા અંગ્રેજી વર્તમાનપત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નામથી સમાચારો પ્રસિદ્ધ થયેલ જેમાં બિહારના કોંગ્રેસનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલનું નામ ગુજરાતમાં બનેલી ઉત્તર ભારતીયો સામેની ઘટના સાથે જોડવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં શક્તિસિંહ ગોહિલે તા:૧૮/૧૦/૨૦૧૮નાં પ્રાથમિક લીગલ નોટીસ અને તા:૧૦/૧૨/૨૦૧૮ની ફાઈનલ લીગલ નોટીસ આપી મુખ્યમંત્રીને ખુલાસો કરવા જણાવ્યું હતું અને જો ખુલાસો ન કરે તો મુખ્યમંત્રીશ્રી સામે દીવાની તથા ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી તેમજ ઉત્તર ભારતીયો પર હુમલા માટે ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જવાબદાર છે તેના પુરાવા આપ્યા હતા.

શક્તિસિંહની લીગલ નોટીસનો પ્રત્યુત્તર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના વકીલ દ્વારા તેમના અસીલની સુચના મુજબ આપવામાં આવ્યો છે. અને તેમાં સમાચારો મુખ્યમંત્રીએ આપ્યા કે અપાવ્યા નથી અને મુખ્યમંત્રીનો ઈરાદો શક્તિસિંહની પ્રતિષ્ઠાને હાની પહોચે તેવો ન હતો તેવો ખુલાસો વ્યક્ત કરાતા પ્રકરણ નો અંત આવેલ છે.

નોંધ:- શ્રી વિજયભાઈ રૂપાણી ને લખેલ પત્રની નકલ આ સાથે સામેલ છે.

પ્રતિ,
તંત્રીશ્રી,

સદરહુ પ્રેસનોટ આપના પ્રતિષ્ઠિત અખબારમાં પ્રસિદ્ધ કરવા માન. શક્તિસિંહ ગોહિલે વિનંતી કરેલ છે.



(સુનિલ રામી)
અંગત મદદનીશ



Shaktisinh Gohil

Incharge Bihar & National Spokesperson, All India Congress Committee.
Former Minister Finance, Education, Health & Planning, Gujarat.
Former Leader of Opposition, Gujarat Legislative Assembly.

સ્નેહી શ્રી, સ્નેહીશ્રી વિજયભાઈ રૂપાણી

તા:૦૨/૦૧/૨૦૧૯

વિષય : અમારી તા:૧૮/૧૦/૨૦૧૮ તથા તા:૧૦/૧૨/૨૦૧૮ની તારીખના સંદર્ભમાં આપના વકીલના દ્વારા અપાયેલ પ્રત્યુત્તર બાબતે.

ઉપરોક્ત વિષય બાબતે સવિનય જણાવવાનું કે અમોએ વર્તમાન પત્રોમાં આપના નામથી મારા સામે પ્રસિદ્ધ થયેલ નામજોગ સમાચારો કે જે સંદંતર ખોટા હોવાના કારણે આપના સામે પ્રતિષ્ઠા ખંડન અંગે દીવાની તથા ફોજદારી કાર્યવાહી કરવા કાયદાની જોગવાઈ મુજબ તા:૧૮/૧૦/૨૦૧૮નાં રોજ પ્રાથમિક નોટીસ અને તા:૧૦/૧૨/૨૦૧૮ના રોજ આખરી નોટીસ આપી હતી. જેના અનુસંધાને આપશ્રીના વકીલ મારફતે આપશ્રીની સુચના મુજબ નોટીસનો પ્રતિઉત્તર કે જે તા:૨૦/૧૨/૨૦૧૮ની તારીખથી લખાયેલ છે. તે મને આજે પ્રાપ્ત થયેલ છે.

આપશ્રીની સુચનાથી આપશ્રીના વકીલ મારફત પ્રથમ અપાયેલ પ્રત્યુત્તર પેરેગ્રાફમાં તા:૧૬/૧૦/૨૦૧૮ના પ્રસિદ્ધ થયેલ સમાચાર માટે લખાયેલ છે. કે “ આ અંગે તમોને જણાવવાનું કે એવા કોઈ સમાચાર અમારા અસીલ તરફથી પ્રસિદ્ધ થયેલ નથી , અને કરાયા પણ નથી “ આ ઉપરાંત પેરેગ્રાફ ૪ માં આપની સુચનાથી આપના વકીલ દ્વારા મને પ્રત્યુત્તરમાં લખવામાં આવ્યું છે કે “ અમારા અસીલ તરફે તમારી પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવો કોઈ ઈરાદો નહોતો ”.

આપના આ પ્રત્યુત્તર સાથે અપેક્ષા રાખું છું કે, ભવિષ્યમાં આપના દ્વારા જ્યારે પણ જાહેરમાં શબ્દો બોલવામાં આવે ત્યારે આપ વિશેષ કાળજી લેશો. કારણ કે આપ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની જવાબદારી વહન કરો છો. ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમી છે અને એક આગવી પ્રતિષ્ઠા ગુજરાતની રહી છે.

ખેર, જ્યારે આપે સમાચાર પ્રસિદ્ધ કર્યા કે કરાવ્યા નથી અને આપનો ઈરાદો મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ન હતો તેવું લખેલ છે માટે આ પ્રકરણ ને હું અહીં પૂર્ણ કરું છું.

આપનાં પ્રત્યુત્તરમાં ગુજરાતમાં બનેલી કમનસીબ ઘટના અંગે સરકારે કાર્યવાહી કરી છે તેનું વિવરણ છે. જેને મારી સંદર્ભ નોટીસ સાથે લેવાદેવા નથી. ગુન્હો કરનાર ગુન્હેગાર તરીકે જ જોવાય તેનો ધર્મ, જાતી કે રાજકીય પક્ષ જોયા વગર તટસ્થતાથી પોલીસ કામગીરી કરે તે કાયદો કહે છે. અને કાયદાનું પાલન યોગ્ય થાય તે આવકારદાયક છે.

કુશળતા ઈચ્છું છું.

સ્નેહાધીન,

(શક્તિસિંહ ગોહિલ)

Office Address : 24, Akbar Road, New Delhi-110011, INDIA. Tel: 91-11-23012411

Ahmedabad Address : 202, Rajvi Tower, Rajvansh Building, Satya Marg, Bodakdev, Ahmedabad-380054 (Gujarat), Tel/Fax: 91-79-26859555

Gandhinagar Address : Plot No. 32, Sector-19, Gandhinagar-382019.

Email : officeofshaktisinh@gmail.com | Website : www.shaktisinhgohil.com